

એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ નં. ૦૧, અમદાવાદ સમક્ષ.

અરજદારની ક્રિ. પ. અ. નં. ૬૧૫૯/૨૦૨૪ ના કામે ક્રિ.પ્રો. કોડની કલમ ૪૫૧
અને ૪૫૭ની અરજી લગત હુકમ.

- (૧) અરજદારની હાલની અરજી વંચાણે લીધી. અરજદાર તથા વિધ્વાન એ.પી.પી.શ્રીને સાંભળ્યા, રજુ દસ્તાવેજો ધ્યાને લીધા. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તેમજ રજુ દસ્તાવેજો ધ્યાને લીધા.
- (૨) હાલના અરજદારે તેઓની અરજીમાં રજુઆત કરેલ છે કે તેઓ અરજીમાં જણાવ્યા મુજબના સરનામે હાલમાં રહે છે તથા તેઓની સાથે સાયબર ક્રાઈમનો બનાવ બનેલ, જે બનાવમાં તેઓના PUNJAB NATIONAL BANK બેંકના ખાતા નં.11302011019252, IFSC:PUNB0027920 માંથી રૂ.27,000/- ઉપડી ગયેલ હતાં. જે બાબતે તેઓએ આશ્વસ્ત પ્રોજેક્ટમાં ૧૦૦ નંબર ઉપર કોલ કરીને ફરિયાદ નોંધાવેલ હતી. જે ફરિયાદ તા.18/03/2024 ના રોજ 31103240042381 ટિકિટ નંબરથી નોંધાયેલ હતી જે સબબ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સામાવાળાના CITY UNION BANK LTD ના ખાતા નં.500101013799936, IFSC:CIUB0000376 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.5,799/-ફોજદારી કાર્યરીતિ સંહિતા અધિનિયમની કલમ ૧૦૨ મુજબ ફીઝ કરાવેલ હતા જે હાલ સુધી સદર બેંકમાં જેમના તેમ પડી રહેલ છે અને તેઓને પરત મળેલ નથી. અરજદારે વધુમાં જણાવેલ છે કે આ બાબતે એફ.આઈ.આર. થયેલ નથી. તેઓને ખુબ જ મોટું આર્થિક નુકસાન થયેલ હોય તથા તેઓને ગુજરાન ચલાવવા માટે સદર રૂપિયાની જરૂર હોય સદર નાણાં તેઓના ખાતામાં પરત અપાવવા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૪૫૧ અને ૪૫૭ મુજબ યોગ્ય તે હુકમ થવા અરજ કરેલ છે.
- (૩) અરજદારની અરજી સબબ તપાસ કરનાર અમલદાર એટલે કે નાયબ પોલીસ અધિક્ષક, સાયબર ક્રાઈમ સેલ, સી.આઈ.ડી.ક્રાઈમનાઓને સદર ગુના બાબતે તમામ પેપર સહિત સ્પષ્ટ અભિપ્રાય રજુ કરવા હુકમ કરવામાં આવેલ.
- (૩.૧) જે અન્વયે ત.ક.અધિકારીએ તેઓનો અભિપ્રાય રજુ કરેલ છે. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તથા લગત કાગળો ધ્યાને લેતાં તેઓએ જણાવેલ છે કે સાયબર

કાઈમનો ભોગ બનનારના નાણાં જ્યારે ઓનલાઈન ટ્રાન્સફર થઈ જતાં હોય છે ત્યારે આવા નાણાંને તાત્કાલિક રોકવા તથા ગુના અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ સામાન્ય નાગરિકો માટે શરૂ કરવામાં આવેલ છે, જે હાલ સ્ટેટ સાયબર કાઈમ સેલ, સી.આઈ.ડી કાઈમ હસ્તક ચાલુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાયબર કાઈમ ઈન્સીડન્ટ રીસ્પોન્સ યુનિટમાં સાયબર કાઈમનો ભોગ બનનારના નાણાં જ્યારે ઓનલાઈન ટ્રાન્સફર થઈ જતાં હોય છે ત્યારે તેને તાત્કાલિક રોકવાની કામગીરી કરવામાં આવે છે. સાયબર કાઈમના ભોગ બનનાર નાગરિકો સીધી જ પોતાની ફરિયાદ ૧૦૦ નંબર(હાલ ૧૯૩૦) પર ડાયલ કરીને લખાવે છે ત્યારે ઈન્સીડન્ટ રીસ્પોન્સ યુનિટ દ્વારા એક ટિકિટ નંબર આપવામાં આવે છે તેમજ સાથોસાથ જે શંકાસ્પદ બેંક ખાતામાં જે તે નાગરિકના નાણાં ગયેલ હોય તે બેંકને નાણાં ફીઝ કરાવવા તેમજ જો નાણાં ત્યાંથી ટ્રાન્સફર થઈ ગયેલ હોય તો તેની માહિતી આપવા માટે તેઓની કચેરીએથી સી.આર.પી.સી. કલમ ૯૧ તથા ૧૦૨ હેઠળ નોટીસ આપવામાં આવે છે. નોટીસના આધારે બેંકો દ્વારા આ શંકાસ્પદ રીતે મેળવાયેલા નાણાં ફીઝ કરવામાં આવે છે.

- (૩.૨) તપાસ કરનાર અધિકારીએ વધુમાં જણાવેલ છે કે હાલના અરજદારશ્રી નાઓ સાથે સાયબર કાઈમનો બનાવ બનેલ હતો. જેમાં અરજદારની PUNJAB NATIONAL BANK બેંકના ખાતા નં.11302011019252, IFSC:PUNB0027920 માંથી રૂ.27,000/-ઉપડી ગયેલ હતાં. જે બાબતે અરજદારે આશ્વસ્થ પ્રોજેક્ટમાં ૧૦૦ નંબર ઉપર કોલ કરીને પોતાની ફરિયાદ કરેલ હતી. જે ફરિયાદ આધારે અરજદારને ટિકિટ નં. 31103240042381 આપવામાં આવેલ. આ અરજદારની ફરિયાદ આધારે સાયબર કાઈમ સેલ સી.આઈ.ડી.કાઈમ દ્વારા અરજદારના ઉપરોક્ત ખાતામાંથી ગયેલ નાણાં પૈકી સામાવાળા શંકાસ્પદ CITY UNION BANK LTDના ખાતા નં.500101013799936, IFSC:CIUB0000376 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.5,799/- સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ ફીઝ કરાવેલ છે. જે નાણાં પાછા ખેંચવા માટે અરજદારશ્રીએ નામદાર કોર્ટમાં અરજી કરેલ હોય અને સારૂ તેઓનો અભિપ્રાય માંગેલ છે જે બાબતે તેઓએ જણાવેલ છે અરજદારશ્રીનાઓના સામાવાળાના શંકાસ્પદ CITY UNION BANK LTD બેંકના ખાતા નં.500101013799936,

IFSC:CIUB0000376 માં તેઓના ગયેલ નાણાં પૈકી રૂ.5,799/- ફીઝ થયેલ છે જે સદર બેંક ખાતું બનાવટી હોવાનું જણાયેલ છે તથા સદરહુ ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ(પોલીસ) સમક્ષ કોઈ વાંધો તકરાર લીધેલ નથી. જેથી તે રૂપિયા અરજદારશ્રીને પાછા આપવા તેઓનો અભિપ્રાય થાય છે.

- (જ) સદર કામે અરજી સાથે રજુ કરવામાં આવેલ બેંક પેપર્સની નકલ ધ્યાને લેતાં તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા રજુ કરવામાં આવેલ અભિપ્રાય તથા તેને લગત કાગળો ધ્યાને લેતાં તે હકીકત સ્પષ્ટ થાય છે કે હાલના અરજદારના PUNJAB NATIONAL BANK બેંકના ખાતા નં.11302011019252, IFSC:PUNB0027920 માંથી રૂ.27,000/-ઉપડી ગયેલ તેમજ સદર નાણાં શંકાસ્પદ CITY UNION BANK LTD બેંકના ખાતા નં.500101013799936, IFSC:CIUB0000376 માં ગયેલ હોય અરજદાર દ્વારા આશ્વસ્થ પ્રોજેક્ટમાં ૧૦૦ નંબર ઉપર કોલ કરીને ફરિયાદ નોંધાવેલ હતી જે ફરિયાદ તા.18/03/2024 ના રોજ 31103240042381 ટિકિટ નંબરથી નોંધાયેલ હતી. આમ, સદર હકીકત ધ્યાને લેતાં અરજદારના ઉપર જણાવ્યા મુજબના ખાતામાંથી નાણાં ઉપડી ગયેલ હોવાનું તથા શંકાસ્પદ બેંકના ખાતામાં ટ્રાન્સફર થયાનું હાલના તબક્કે સ્પષ્ટ જણાઈ આવે છે. તદઉપરાંત રેકર્ડ પરની હકીકત ધ્યાને લેતાં હાલના કામે આજદિન સુધી કોઈ એફ.આઈ.આર. થયેલ હોય કે હાલના કામે કોઈની ઘરપકડ કરવામાં આવેલ હોય તેમ જણાઈ આવતું નથી. તેમજ બનાવ બન્યાને આટલો લાંબો સમય પસાર થયેલ હોવા છતાં આજદિન સુધી અરજદાર સિવાય અન્ય કોઈએ સદર નાણાંની અત્રેની અદાલત સમક્ષ માંગણી કરતી કોઈ અરજી કરેલ નથી. તદઉપરાંત તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય ધ્યાને લેતાં તેઓ સમક્ષ પણ કોઈએ આ નાણાંની માંગણી કરેલ હોય તેમ જણાતું નથી તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા સદર બેંક ખાતા બનાવટી હોવાનું જણાવેલું છે તથા સદરહુ ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી. જેથી, તપાસ કરનાર અમલદાર દ્વારા સદર નાણાં અરજદારશ્રીને પાછા આપવા સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે. જેથી અત્રેની અદાલતના માનવા મુજબ હાલના અરજદાર સદર નાણાંનો કબજો મેળવવા

હકકદાર હોવાનું જણાય છે.

- (જ.૧) આમ, સદર કેસની તમામ હકીકતો, સંજોગો તથા રજુ દસ્તાવેજો ધ્યાને લેતાં સદર નાણાં બેંકમાં જમા હોય તેથી સદર રોકડ રકમના દર તેમજ સીરીયલ નંબર બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેમજ ભવિષ્યમાં પણ મુદ્દામાલની ઓળખ બાબતની કોઈ તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી. વધુમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ કલમ ૪૫૧ અને ૪૫૭ તથા નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સુંદરભાઈ અંબાલાલ દેસાઈ વિ. ગુજરાત રાજ્ય, ૨૦૦૩(૧) જી.એલ.એચ. પાના નં.૩૦૭ના ચુકાદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતો ધ્યાને લેતાં તથા ઉપરોક્ત જણાવેલ કારણોસર હાલની અરજી મંજૂર કરવા પાત્ર જણાતી હોય ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

- :: હુકમ :: -

(૧) અરજદારશ્રી સોનલબેન દિનેશભાઈ સૈની ની અરજી ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૪૫૭ હેઠળ મંજૂર કરવામાં આવે છે.

(૨) અરજદારને સદર ગુનાના કામે સીઝ કરવામાં આવેલ રોકડ રકમ રૂ.5,799/- પુરાના દોઢી રકમના જાત જામીન (બોન્ડ) તથા તેટલી જ રકમના સદ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપ્યેથી આ કેસના આખરી નિકાલ સુધી નીચેની શરતોને આધિન વચગાળાની કસ્ટડી સ્વરૂપે પરત સોંપવાનો હુકમ કરવામાં આવે છે.

(૩) વધુમાં હુકમ કરવામાં આવે છે કે અરજદાર દ્વારા હુકમ મુજબના જાત જામીન (બોન્ડ) તથા સદ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપ્યેથી પોલીસ અધિકારી દ્વારા તે મતલબની જાણ તથા સદર હુકમની જાણ જે તે બેંકને કરવી તેમજ CITY UNION BANK LTDને હુકમ કરવામાં આવે છે કે, તેઓએ પોલીસ અધિકારી દ્વારા અરજદારે હુકમ મુજબના જાત જામીન (બોન્ડ) તથા સદ્ધર જામીન પોલીસ સ્ટેશન માં આપેલ હોવાની તથા સદર હુકમની જાણ મળ્યેથી દિન-૧૦માં તેમની બેંકના ખાતા નં.500101013799936, IFSC:CIUB0000376 માં અરજદારના જે રૂ.5,799/-જમા છે તે રકમ અરજદારના PUNJAB NATIONAL BANK બેંકના ખાતા નં.11302011019252, IFSC:PUNB0027920 માં જમા કરાવી તેની જાણ અત્રેની અદાલતને તથા લગત પોલીસ સ્ટેશનને કરવી.

શરતો.

(૧) અત્રેની અદાલત જ્યારે ફરમાવે ત્યારે અરજદારે આ નાણાં અદાલત સમક્ષ રજુ કરવાના રહેશે.

(૨) ઉપરોક્ત ખાતાધારક વ્યક્તિ કે અન્ય કોઈ વ્યક્તિ સદર નાણાં પર કલેઈમ કરે અને પોતાનો હકક/હિત પુરવાર કરે તેવા સંજોગોમાં અરજદારે સદર રકમ પરત કરવાની રહેશે.

(૩) સદર મુદ્દામાલ રકમનો કોઈ ગુનાહિત કામે ઉપયોગ કરવો/કરાવવો નહીં.

(૪) કોઈ પણ શરતનો ભંગ થયેથી હાલનો વચગાળાનો હુકમ આપોઆપ રદ ગણાશે તથા મુદ્દામાલ રોકડ રકમ ફરીથી જપ્ત થવાને પાત્ર રહેશે તથા બોન્ડ અને જામીનગરીની રકમ પણ વસુલ કરવાને પાત્ર રહેશે.

હુકમ આજરોજ તા.૨૨ મી માહે જુન સને ૨૦૨૪ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી,સંભળાવી જાહેર કર્યો.

તા.૨૨/૦૬/૨૦૨૪
અમદાવાદ.

(શ્રી બી.પી મહીડા)
કોડ નં.-૦૧૧૨૨
એડિ.ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ,
કોર્ટ નં.૧, અમદાવાદ.